

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજ ખાતે વેર હાઉસ ડેવલપમેન્ટ અને રેગ્યુલેટરી ઓથોરીટી ના

સહયોગથી એક દિવસીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવાતજ ખાતે વેર હાઉસ ડેવલપમેન્ટ અને રેગ્યુલેટરી ઓથોરીટી ના સહયોગથી સુરક્ષિત અનાજ સંગ્રહ અંતર્ગત તા. ૨૧/૦૧/૨૦૨૧ ના રોજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં અલગ-અલગ ગામનાં કુલ ૫૦ ખેડૂતોએ ભાગ લીધેલ. ઉદયભાણસિંહજી રીઝીયોનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા શ્રીમતી નીલુ પાંડે, ડાયરેક્ટર, પીજી ડીપ્લોમા ઇન મેનેજમેન્ટ તેમજ કેન્દ્રીય ભંડારણ નિગમનાં નિવૃત્ત મેનેજર શ્રી સુધર સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કે.વિ.કે. ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી ડો. જી. જી. પટેલે સર્વેનું સ્વાગત કર્યા બાદ જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમજાવી પાકની કાપણી કર્યા બાદ અનાજને સુરક્ષિત રાખી વેચાણ કર્યા વિના રજીસ્ટર્ડ ગોડાઉનમાં જમા કરાવી પાવતી પર લોન મેળવી શકાય તેમજ યોગ્ય સમયે વેચાણ કરવા બાબતે જરૂરી સુચનો કર્યા. શ્રીમતી નીલુ પાંડે દ્વારા કેન્દ્રીય ભંડારણ નિગમની જવાબદારીઓ તેમજ તેની વિશ્વસનીય કામગીરી બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું. શ્રી સુધર સિંઘ એ અન્નના મહત્વ વિષે વિસ્તૃત જાણકારી આપી તેમજ તેનો વ્યય કરવો જોઈએ નહી તેમ જણાવ્યું. તેઓએ અનાજનું ગ્રેડીંગ, સ્ટોરેજ, ધુમિકરણ, વિમા પોલીસી વિષે ઉંડાણપૂર્વક ચર્ચા કરી. કાર્યક્રમના ભાગ રૂપે ખેડૂતોને સોજીત્રા તાલુકાના દુધીપુરા ગામ ખાતે આવેલ વેર હાઉસ ની મુલાકાત કરાવવામાં આવી તેમજ વેર હાઉસમાં અનાજની વૈજ્ઞાનિક રીતે ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી તૈયાર કરવામાં આવેલ સ્ટ્રક્ચર અને સંગ્રહ પદ્ધતિ વિષે શ્રી સુધર સિંઘ દ્વારા ખેડૂતોને સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું. કેવિકેનાં વૈજ્ઞાનિક (એગ્રોનોમી) ડો. વાય.સી.લકુમ દ્વારા અનાજનાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે સવિસ્તાર માહિતી આપવામાં આવી. ડો. આર. એમ. પટેલ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા સંગ્રહેલ અનાજમાં નુકશાન કરતી જીવાતો અને તેના બીન-રાસાયણિક નિયંત્રણ વિષે માહિતી આપવામાં આવી.

કાર્યક્રમનાં અંતે ડો. વાય.સી.લકુમ, વૈજ્ઞાનિક (એગ્રોનોમી) દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી પૂર્ણાહુતિ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. આર. એમ. પટેલ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) અને ડો. વાય.સી.લકુમ, વૈજ્ઞાનિક (એગ્રોનોમી) દ્વારા કરવામાં આવેલ.

कार्यक्रमની ઝાંખીઓ

